



પ્રેસનોટ-૦૧

તા. ૨૯.૦૧.૨૦૧૯

પેટા ચૂંટણીઓમાં ૧૨ માંથી ૧૦ બેઠક ઉપર ભાજપાનો ભવ્ય વિજય

કોંગ્રેસની ત્રણ બેઠક પર ડિપોઝિટ થઈ ડૂલ

નગરપાલિકા અને મહાનગરપાલિકાના આજના પરિણામો આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કેસરીયો લહેરાવાના સંકેત સમાન – શ્રી જીતુભાઈ વાઘાણી

ભાજપાની વિચારધારા તથા કેન્દ્ર અને ગુજરાત સરકારની વિકાસયાત્રા પર ગુજરાતની જનતા દ્વારા મંજૂરીની મહોર – શ્રી ભરત પંડ્યા

નગરપાલિકાના પેટા ચૂંટણીના પરિણામોએ ભાજપાને સાથ આપીને કોંગ્રેસના નકારાત્મકતાનાં હાથને નકારી દીધો છે – શ્રી ભરત પંડ્યા

ભાજપાના પ્રદેશ પ્રવક્તાશ્રી ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, આજે રાજકોટ મહાનગરપાલિકાની ૦૧ અને વિવિધ ૧૧ નગરપાલિકાઓની ૧૧ એમ કુલ ૧૨ પેટા ચૂંટણીઓના પરિણામોમાં ભાજપને ૧૨ માંથી ૧૦ સીટ ઉપર ભવ્ય વિજય થયો છે. જ્યારે કોંગ્રેસને માત્ર બે સીટ મળી છે. કોંગ્રેસની ત્રણ સીટ પર ડિપોઝિટ પણ ડૂલ થઈ છે. ખેડા જિલ્લાની નડિયાદ નગરપાલિકા વોર્ડ નંબર-૦૭, કચ્છ જિલ્લાની ગાંધીધામ નગરપાલિકા વોર્ડ નંબર-૨, ગીર-સોમનાથ જિલ્લાની સુત્રપાડા નગરપાલિકાની વોર્ડ નંબર-૦૩, એમ કુલ ત્રણ જગ્યાએ કોંગ્રેસને ડિપોઝિટ ડૂલ થઈ છે.

પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીએ ગુજરાતની જનતાનો ભાજપાને વિજયી બનાવવા બદલ હૃદયપૂર્વક આભાર માનતા જણાવ્યું હતું કે, નગરપાલિકા અને મહાનગરપાલિકાના આજના પરિણામો આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કેસરીયો લહેરાવાના સંકેત સમાન છે. કોંગ્રેસના અપ્રચારની આંધીને ગુજરાતના રાષ્ટ્રવાદી મતદારો ભાજપા તરફી મતદાન કરીને ગુજરાતના ગૌરવ શ્રી નરેન્દ્રભાઈ મોદીને પુનઃ વડાપ્રધાન તરીકે પ્રસ્થાપિત કરશે. સાથે સાથે ભાજપાના વિજયી ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા.

કોંગ્રેસની નકારાત્મકતા, અપ્રચાર, વેરઝેર અને અશાંતિ ફેલાવનારી રાજનીતિને ગુજરાતની જનતાએ ક્યારેય સ્વીકારી નથી અને ક્યારેય સ્વીકારશે પણ નહીં.

શ્રી પંડ્યાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોઈપણ પેટાચૂંટણીઓ હોય તેમાં ગુજરાતની જનતા ભાજપને જનસમર્થન અને જનમત આપે છે. ભાજપાની વિચારધારા તથા કેન્દ્ર અને ગુજરાત સરકારની વિકાસયાત્રાને ગુજરાતની જનતાએ મંજૂરીની મહોર મારી છે. છેલ્લે જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી હોય કે સાથે-સાથે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકાની પેટા ચૂંટણીઓના પરિણામો હોય ત્યારે હંમેશા ભાજપાને સાથ આપીને કોંગ્રેસના નકારાત્મકતાનાં હાથને નકારી દીધો છે અને જુઠ્ઠાણાને પરાસ્ત કર્યો છે.

(ડૉ. હર્ષદ પટેલ)

પ્રદેશ કન્વીનર, મીડીયા વિભાગ

ભારતીય જનતા પાર્ટી

ગુજરાત પ્રદેશ

શ્રી કમલમ્



પ્રેક્ષા વિશ્વ ભારતીની સામે, કોબા સર્કલ-ગાંધીનગર રોડ, કોબા, ગાંધીનગર-૩૮૨૦૦૭ (ગુજરાત)

Phone : (079) 23276947, 23276948, 23276949 Fax : (079) 23276943 • Email : bjp.gujarat@gmail.com • Web : www.bjpgujarat.org

પ્રેસનોટ-૦૨

તા. ૨૯.૦૧.૨૦૧૯

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રની ભાજપા સરકારે છેલ્લા પાંચ વર્ષમાં સમાજના દરેક વર્ગોમાં વિકાસ માટેની નક્કર યોજનાઓનું અમલીકરણ કરીને “સૌનો સાથ સૌનો વિકાસ”ના મંત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કર્યો છે.

“શ્રી કમલમ્” ખાતે પ્રબુધ્ધ નાગરિક સંમેલનની પૂર્વતૈયારી માટે બેઠક યોજાઈ

પ્રદેશ ભાજપા મીડિયા સેલની યાદી જાણાવે છે કે, આજરોજ ભાજપા પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ્” ખાતે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને લોકસભા ચૂંટણી પ્રભારી શ્રી ઓમપ્રકાશ માથુરજીની વિશેષ ઉપસ્થિતિમાં અને પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં પ્રબુધ્ધ નાગરિક સંમેલનની પૂર્વતૈયારી માટે બેઠક યોજાઈ હતી.

આગામી લોકસભાની ચૂંટણી પહેલા સમગ્ર ગુજરાતમાં ૨૬ લોકસભા વિસ્તારમાં ક્લસ્ટર વાઈઝ ૯ જેટલા પ્રબુધ્ધ નાગરિક સંમેલનોનું આયોજન કરવામાં આવ્યું છે.

આજની બેઠકમાં વિસ્તૃત માર્ગદર્શન આપતા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને લોકસભા ચૂંટણી પ્રભારી શ્રી ઓમપ્રકાશ માથુરજીએ જાણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રની ભાજપા સરકારે છેલ્લા પાંચ વર્ષમાં સમાજના દરેક વર્ગોમાં વિકાસ માટેની નક્કર યોજનાઓનું અમલીકરણ કરીને “સૌનો સાથ સૌનો વિકાસ”ના મંત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કર્યો છે. પ્રબુધ્ધ નાગરિક સંમેલનો દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં તમામ મોરચે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતને મળેલી સફળતાની સિધ્ધિઓ તેમજ જનકલ્યાણ કાર્યોનો હિસાબ જનતાની અદાલતમાં રજૂ કરવામાં આવશે.

શ્રી ઓમજી માથુરે જાણાવ્યું હતું કે, “સાફ નીયત, સહી વિકાસ” ના મંત્ર સાથે કેન્દ્ર સરકારે પાંચ વર્ષમાં સંપૂર્ણ પ્રમાણિકતા અને ખંતથી જનતા જનાર્દનની સેવા કરી છે. ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા જનજનના વિકાસ માટે કાર્યરત છે ત્યારે ભાજપાએ કરેલા નક્કર કાર્યો અને ભારતવિકાસની વાતો જનજન સુધી પહોંચાડવાના મંત્ર સાથે સૌ કાર્યરત બને અને ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર ભાજપાના ભવ્ય વિજયને નિશ્ચિત બનાવીને રાષ્ટ્રહિત માટે શ્રી નરેન્દ્રભાઈ મોદીને પુનઃ પ્રધાનમંત્રી બનાવીને ભવ્ય ભારતના નિર્માણમાં સહયોગી બનીએ.

આજની આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઈ દલસાણીયા, પ્રદેશ મહામંત્રીશ્રી ભરતસિંહ પરમાર, પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, પ્રદેશ પ્રવક્તાશ્રી ભરતભાઈ પંડ્યા અને પ્રબુધ્ધ નાગરિક સંમેલનના પ્રદેશ સંયોજકશ્રી અનીલ પટેલ સહિત ગુજરાત ભાજપાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(ડૉ. હર્ષદ પટેલ)

પ્રદેશ કન્વીનર, મીડિયા વિભાગ